



પોલીસ કમિશ્નરની કચેરી, સુરત શહેર.  
પોલીસ ભવન, અઠવાલાઇનસ, સુરત શહેર-૩૯૫૦૦૧  
વિશેષ શાખા, કચેરી ટેલીફોન-૦૨૬૧ ૨૨૪૧૧૧૦  
કંટ્રોલ રૂમ ફેક્સ નં. ૦૨૬૧ ૨૨૪૧૩૦૪  
e-mail : special.cp.sur@gmail.com



**-:: ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ તથા**

**જી.પી.એફટ કલમ- ૩૭ (૪) અન્વયે કરેલ હુકમ ::-**

**ક્રમાંક:એસ.બી./કોરોના વાયરસ/૧૭૪/૨૦૨૧**

વંચાણે લીધા

(૧) ગ્રુહવિભાગ સચિવાલય ગાંધીનગર ક્રમાંક:વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- A તા.૨૪/૦૯/૨૦૨૧

(૨) ગ્રુહ મંત્રાલય ભારત સરકારના તા.૨૯/૦૪/૨૦૨૧ ના પત્રક્રમાંક: 40-3/2020- DM-I (A) અન્વયે

૧. રાજ્યમાં covid-19 ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગ્રુહ વિભાગના તા. ૨૯/૦૭/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- A થી રાજ્યના ૦૮ શહેરોમાં તા. ૦૧/૦૮/૨૦૨૧ ના સવારના ૦૬/૦૦ કલાક સુધી રાત્રી કફરુ તથા કેટલાક નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ હતા. જે વખતો-વખતના હુકમથી તા.૨૫/૦૯/૨૧ના સવારના ૦૬/૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે.

૨ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાયલ છે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિની પુન:સમિક્ષા તા.૨૯/૦૭/૨૦૨૧ના હુકમ ક્રમાંક: -૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- A થી મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબના નિર્ણયો કરવામાં આવેલ.

૩. સુરત શહેરમાં તા.૨૫/૦૯/૨૦૨૧ના રાત્રીના ૧૨/૦૦ કલાક થી તા.૧૦/૧૦/૨૦૨૧ સવારના ૦૬/૦૦ કલાક સુધી (દરરોજ રાત્રીના ૧૨/૦૦ કલાકથી સવારના ૦૬/૦૦ કલાક સુધી) રાત્રી કફરુ અમલમાં મુકવામાં આવે છે.

સુરત શહેર વિસ્તાર વસ્તીની દ્રષ્ટીએ ગીચ અને ભીડભાડ વાળુ હોય નોવેલ કોરોના વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે જાહેર જનતાના હિતમાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને ૧૯૭૩ ની કલમ ૧૪૪ અન્વયે હું અજયકુમાર તોમર (આઇ.પી.એસ.) પોલીસ કમિશ્નર, સુરત શહેર નીચે મુજબનો હુકમ કરું છું.

**:-વિસ્તાર:-**

સુરત શહેર પોલીસ કમિશ્નરેટ હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર.

**:-હુકમ :-**

**રાત્રી કફરુ સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.**

- (૧) બિમાર વ્યક્તિ,સગર્ભાઓ,અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છુટ રહેશે.
- (૨) મુસાફરોને રેલ્વે,એરપોર્ટ ST કે સીટી બસની ટીકીટ રજુ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
- (૩) રાત્રી કફરુના સમયગાળા દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં.
- (૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યે થી જરૂરી ઓળખપત્ર રજુ કરવાના રહેશે.
- (૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર , ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન,સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
- (૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય

અભિગમ દાખવવાનો રહેશે.

૪.

**::નિયંત્રણો::**

ગૃહ વિભાગના સમાન ક્રમાંકના હુકમથી અમલી કરવામાં આવેલ નીચે મુજબના નિયંત્રણો તા.૨૫/૦૯/૨૦૨૧ ના સવારના ૦૬/૦૦ કલાક થી તા.૧૦/૧૦/૨૦૨૧ ના સવારના ૦૬/૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા દરમ્યાન સુરત શહેરમાં નીચે મુજબના નિયંત્રણો અમલમાં મૂકવામાં આવે છે.

- A. તમામ દુકાનો, વાણીજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
- B. રેસ્ટોરેન્ટ્સ રાત્રીના ૧૦/૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.
- C. રેસ્ટોરેન્ટ્સ HOME Deliveryની સુવિધા રાત્રીના ૧૨/૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
- D. જીમ ૭૫ % ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે.
- E. જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૧૦/૦૦ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ખુલ્લા રાખી શકાશે.
- F. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ (ચારસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે .લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.
- G. અંતિમ ક્રિયા / દફન વીધી માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે.
- H. તમામ પ્રકારના રાજકીય/સામાજિક/શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ધાર્મિક કાર્યક્રમોમાં જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન , ખુલ્લામાં . મહત્તમ ૪૦૦ (ચાર સો) વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦ % (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકાશે.
- I. ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સુધીના કોચીંગ સેન્ટરો/ ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P સાથે ચાલુ રાખી શકાશે.
- J. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
- K. શાળા , કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક /ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P સાથે યોજી શકાશે.
- L. વાંચનાલયો ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે.
- M. પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી બસ સેવાઓ ૧૦૦ % ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કફ્ટ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે
- N. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ/ સ્પોર્ટ્સ સ્ટેડીયમ/ સંકુલમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે.
- O. સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે.
- P. વોટર પાર્ક, તથા સ્વિમિંગ પૂલ મહત્તમ ૭૫% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે
- Q. સ્પા સેન્ટરો બંધ રહેશે.
- R. ઉપરોક્ત A,B,D,I,L,M,N,O,P માં જણાવેલ બાબતો સંદર્ભમાં તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝિટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝિટીવ આવ્યાના ૧૪ દિવસ થી /

હોસ્પીટલની ડીસ્ચાર્જ સમરીની તારીખ થી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

૩. (૧) નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં રાત્રીના ૧૨/૦૦ કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનુ આયોજન તેમજ દુર્ગા પુજા, શરદપુર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા/ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઈશે. આવા આયોજનમાં લાઉડ સ્પીકર/ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનુ પાલન કરવાનુ રહેશે. પરંતુ રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઈપણ જગ્યાએ કે જ્યા કોમર્શિયલ રીતે ગરબાનુ આયોજન કરવામાં આવતુ હોય તેવા સ્થળોએ નવરાત્રીની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.

૪. આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/પ્રવૃત્તિઓ કોઈ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે.

- (૧) COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.
- (૨) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
- (૩) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
- (૪) ડેરી,દુધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન,વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
- (૫) શાકભાજી માર્કેટ તથા ફુટ માર્કેટ .
- (૬) કરિયાણું,બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
- (૭) અનાજ તથા મસાલા દળવાની ઘંટી
- (૮) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
- (૯) ઇન્ટરનેટ/ટેલિફોન/મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/આઇ.ટી અને આઇ.ટી સંબંધિત સેવાઓ.
- (૧૦) પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા,ન્યુઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન.
- (૧૧)પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી /સી.એન.જી /પી.એન.જી ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન ,ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
- (૧૨) પોસ્ટ અને કુરીયર સર્વિસ
- (૧૩) ખાનગી સિક્યુરીટી સેવાઓ
- (૧૪) પશુ આહાર ઘાસ ચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધીત સેવાઓ
- (૧૫) કૃષિ કામગીરી, પેસ્ટ કંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરીવહન અને પુરવઠા વ્યવસ્થા
- (૧૬) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરીવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ
- (૧૭) આંતર રાજ્ય, આંતર જીલ્લા, અને આંતર શહેરોની ટ્રાન્સપોર્ટ સેવાઓ અને તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ
- (૧૮) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પુરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- (૧૯) બાંધકામને લગતી પ્રવૃત્તિ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૫. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
૬. તમામે ફેસ કવર,માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

**-:શિક્ષા:-**

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર THE EPIDEMIC DISEASES ACT 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 ની જોગવાઈઓ, ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, જી.પી.એક્ટ ૧૩૫ તથા, The Disaster Management Act, ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

**-:જાહેર વિજ્ઞાપન:-**

હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલ ચોંટાડી, લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રો ઉપરથી પ્રસિધ્ધ કરાવવું.

આ હુકમ અન્વયે સુરત કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, જી.પી.એક્ટ ૧૩૫, THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 અને લાગુ અન્ય કાનૂની જોગવાઈઓ સહિત, The Disaster Management Act, 2005 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૨૫/૦૯/૨૦૨૧ ના રોજ મારી સહી અને સિક્કા કરી આપેલ છે.



(અજયકુમાર તોમર)  
પોલીસ કમિશ્નર,  
સુરત શહેર.

**પ્રતિ,**

- (૧) અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧,૨ તથા ટ્રાફિક એન્ડ ક્રાઇમ સુરત શહેર.
- (૨) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર
- (૩) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, તમામ સુરત શહેર
- (૪) તમામ પો.સ્ટે./ શાખા ઇન્ચાર્જશ્રીઓ, સુરત શહેર.(નકલો ચોંટાડી લાઉડ સ્પીકર, વાહન ધ્વારા જાહેરાત કરાવવા સારું)
- (૫) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુરત શહેર (તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

**સવિનય નકલ રવાના :-**

- (૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગર.
- (૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગર.
- (૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર/વડોદરા શહેર.
- (૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત રેન્જ, સુરત.
- (૬) કલેક્ટરશ્રી, સુરત શહેર.
- (૭) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, સુરત શહેર
- (૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટે.) સુરત રીજીયન, સુરત
- (૯) પોલીસ અધિક્ષકશ્રી, સુરત રૂરલ.
- (૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગર.

- (૧૧) જીલ્લા સરકારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુરત.
- (૧૨) મેનેજરશ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિધ્ધ કરવા સારૂ).
- (૧૩) પો.ઈન્સ.શ્રી, સુરત રેલ્વે પો.સ્ટે.
- (૧૪) રજીસ્ટ્રારશ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
- (૧૫) રજીસ્ટ્રારશ્રી, ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સુરત .
- (૧૬) રજીસ્ટ્રારશ્રી, ચીફ જ્યુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુરત.
- (૧૭) વધારાના એકઝીક્યુટીવ મેજી.શ્રી, સુરત શહેર.( નાનપુરા બહુમાળી સુરત )
- (૧૮) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. ( જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત
- (૧૯) સંયુક્ત માહિતી નિયામકશ્રી, સુરત ( સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા સારૂ.)